



RAA-007-1016011 Seat No. _____
Third Year B. Sc. (Sem. VI) (CBCS) Examination
March - 2019
Home Science : Paper - 4
(Canteen Management)
(New Course)

Faculty Code : 007
Subject Code : 1016011

Time : 2 Hours]

[Total Marks : 50

સૂચના : પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.

- | | | |
|---|--|----|
| ૧ | કેન્ટીન મેનેજમેન્ટનો અર્થ લખી તેના લક્ષણો વર્ણવો. | ૧૦ |
| | અથવા | |
| ૧ | હિસાબના પ્રકારો વર્ણવો. | ૧૦ |
| ૨ | કેન્ટીનના હેલ્પર્સને અપાતી ટ્રેનીંગની જરૂરિયાત જણાવો. | ૧૦ |
| | અથવા | |
| ૨ | કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોની ખરીદી તથા સ્ટોરેજની વ્યવસ્થા વિશે લખો. | ૧૦ |
| ૩ | કેન્ટીનમાં વાનગીની કિંમતને અસરકર્તા પરિબલો વર્ણવો. | ૧૦ |
| | અથવા | |
| ૩ | કેન્ટીનમાં હાઈજીન અને સેફ્ટી વિશે લખો. | ૧૦ |
| ૪ | કેન્ટીનમાં હિસાબ રાખવાના ફાયદા વર્ણવો. | ૧૦ |
| | અથવા | |
| ૪ | કેન્ટીન મેનેજમેન્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વર્ણવો. | ૧૦ |
| ૫ | ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)
(૧) કેન્ટીનમાં ટેબલ-સેટીંગ
(૨) કેન્ટીનમાં લાઈટીંગ તથા ફલાવર-એરેંજમેન્ટ
(૩) કેન્ટીનમાં રંગ તથા ચિત્રોનું મહત્ત્વ
(૪) કેન્ટીનમાં કુર્કીંગ તથા પ્રેઝન્ટેશન ટેકનીક્સ. | ૧૦ |

ENGLISH VERSION

Instruction : The digit on the right side indicate marks.

1 Write about the meaning and characteristics of Canteen-Management. **10**

OR

1 Describe the types of Account Keeping. **10**

2 Describe the need of the training for the helpers working in the canteen. **10**

OR

2 Write about the purchase and storage of food stuffs in the Canteen. **10**

3 Write about the factors affecting the cost of the food, served in the canteen. **10**

OR

3 Write about the hygiene and safety in the canteen. **10**

4 Describe the advantages of Account Keeping. **10**

OR

4 What points should be considered while managing the canteen ? **10**

5 Write short notes : (any two) **10**

(1) Table-setting

(2) Lighting and Flower Arrangement in the canteen.

(3) Importance of colour and pictures in the canteen.

(4) Cooking and presentation techniques in the canteen.